

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,

બ્લોક નં.૨, પહેલો માળ, “કર્મયોગી ભવન” નિર્માણ ભવનની પાછળ, સેક્ટર-૧૦-એ, ગાંધીનગર.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, દ્વારા બિન સચિવાલય કારકુન તથા સચિવાલય સેવાના ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગની જગાઓ માટે જાહેરાત ક્રમાંક: ૮૩/૨૦૧૬૧૭ અન્વયે તા.૧૬/૧૦/૨૦૧૬નાં રોજ લેવાયેલ લેખીત સ્પર્ધાત્મક પરીક્ષા ભાગ-૧ તથા તા. ૦૩/૦૧/૨૦૧૭ થી તા. ૧૨/૦૧/૨૦૧૭ સુધી યોજવામાં આવેલ કોમ્પ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટને અંતે આખરી પસંદગી / પ્રતિક્ષા યાદી મંડળ ધ્વારા તા. ૧૯/૦૪/૨૦૧૭ના રોજ જાહેર કરવામાં આવેલ. આ પ્રતિક્ષાયાદીમાં સમાવિષ્ટ નીચેના ઉમેદવારોને ઉપલબ્ધ ખાલી જગાઓ ધ્યાને લઈ, અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવેલ છે. તેવા ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમ માટેની સુચનાઓ.

સંબંધિત ઉમેદવારોએ નીચે મુજબના તારીખ, સમય અને સ્થળે સ્વખર્ચે હાજર રહેવાનું જણાવવામાં આવે છે.

સ્થળ:- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બ્લોક નં.૨, પહેલો માળ, “કર્મયોગી ભવન” નિર્માણ ભવનની પાછળ, સેક્ટર-૧૦-એ, ગાંધીનગર..

D.V. S.R NO.	WAI TLI ST NO.	CANDI DATE'S NAME	GENDER	DATE & TIME
1	489	M. AJ AYKUMAR CHI MANLAL VANI	M	26/7/2019 15:00 PM
2	799	M. ANKI TA SURESHBHAI MAKWANA	F	26/7/2019 15:00 PM

:- ઉમેદવારો માટેની અગત્યની સુચનાઓ :-

૧. તમામ ઉમેદવારો માટેની સૂચના:

(૧) તમામ ઉમેદવારોએ ઉપરોક્ત સ્થળે નીચેના અસલ પ્રમાણપત્રો /દસ્તાવેજો અને તેનો સ્વ-પ્રમાણિત ૧ ઝેરોક્ષ સેટ તેમજ પાસપોર્ટ સાઇઝનો એક ફોટો અચુક સાથે લાવવાના રહેશે. અસલ પ્રમાણપત્રો રજૂ કરવામાં નહિ આવે તો જે દિવસે અસલ પ્રમાણપત્ર રજૂ કરશે તે દિવસે ઉપલબ્ધ જગાઓમાંથી પસંદગી કરવા દેવામાં આવશે.

(ક) ધોરણ-૧૨ની માર્કશીટ અથવા પ્રમાણપત્ર

(ખ) ધોરણ-૧૦ની માર્કશીટ અથવા પ્રમાણપત્ર

(ગ) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

(૨) સામાન્ય વહીવટ વિભાગના તા.૧૩/૦૮/૨૦૦૮ના ઠરાવ મુજબનું કોમ્પ્યુટરના બેઝીક નોલેજ બાબતનું પ્રમાણપત્ર

(૩) એસ.સી./એસ.ટી./એસ.ઇ.બી.સી. વર્ગના ઉમેદવારો માટે જાતિ અંગેનું સક્ષમ અધિકારી ધ્વારા અપાયેલ પ્રમાણપત્ર

(૪) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ઉન્નત વર્ગમાં સમાવેશ થતો ન હોવા અંગેનું નિયત નમૂનાનું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા.૨૭/૦૪/૨૦૧૦ ના ઠરાવથી નિયત થયેલ **પરિશિષ્ટ-૪ (ગુજરાતી)** ના નમૂનામાં તા.૦૧/૦૪/૨૦૧૫ થી તા.૩૧/૦૩/૨૦૧૬ ના સમયગાળાની આવકને ધ્યાને લઈ, તા.૦૧/૦૪/૨૦૧૬ થી અરજી કરવાની છેલ્લી તા.૨૦/૦૬/૨૦૧૬ સુધીના સમયગાળાનું ઉન્નત વર્ગમાં સમાવેશ થતો ન હોવા અંગેનું પ્રમાણપત્ર અરજીમાં દર્શાવ્યા મુજબના પ્રમાણપત્રના નંબર અને તારીખવાળું લાવવાનું રહેશે.

૨. વધુમાં અસલ પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમના સ્થળે તારીખ અને સમય મુજબ ફરજિયાત હાજર રહેવાનું છે.
૩. **બિન સચિવાલય કારકુન** વર્ગ -૩ સંવર્ગની ફાળવણી સંદર્ભે ઉમેદવારે કાર્યક્રમના સ્થળે ઉપલબ્ધ જગ્યાઓ પૈકી પસંદગી દર્શાવવાની રહેશે. પ્રમાણપત્રો ચકાસણીનાં સમયે ઉપલબ્ધ જગ્યાઓ પ્રમાણે ઉમેદવારે દર્શાવેલ પસંદગી / પ્રેફરન્સ આખરી અને તેને બંધનકર્તા રહેશે, જેમાં પાછળથી કોઇપણ તબક્કે ફેરફાર કરી શકાશે નહીં. જે ધ્યાને લઇ ખુબજ કાળજીપુર્વક પસંદગી / પ્રેફરન્સ દર્શાવવાના રહેશે. પ્રમાણપત્રોની ચકાસણી સ્થળે કોઇ પણ ઉમેદવારની સાથે આવેલ વાલીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમ સ્થળે ઉમેદવારો દ્વારા મોબાઇલનાં ઉપયોગનો પ્રતિબંધ છે.
૪. ઉમેદવારે પોતાનું કોઇપણ એક આઇડેન્ટિટી પ્રૂફ જેવું કે ડ્રાઇવિંગ લાઇસન્સ, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ કે પાનકાર્ડ અચૂક સાથે લાવવાનું રહેશે તેમજ તેની ૧ ઝેરોક્ષ નકલ સ્વ-પ્રમાણિત કરી આપવાની રહેશે.
૫. મહિલા ઉમેદવાર જો પરણિત હોય અને અરજી તેમજ પ્રમાણપત્રોના નામમાં વિસંગતતા હોય તો લગ્ન નોંધણી પ્રમાણપત્ર/સરકારી ગેઝેટ કે એફીડેવિટ રજૂ કરવાના રહેશે.
૬. ઉમેદવારોની ફાળવણી તેમના અસલ પ્રમાણપત્રોની ચકાસણીને આધીન રહેશે. ઉમેદવારે રજૂ કરેલ પ્રમાણપત્રો / દસ્તાવેજોમાં અને ઉમેદવારની અરજીની વિગતોમાં જો કોઇ વિસંગતતા જણાશે તો આ બાબતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ધ્વારા જે કોઇ નિર્ણય કરવામાં આવે તે આખરી અને ઉમેદવારને બંધનકર્તા રહેશે.
૭. પ્રમાણપત્રોની ચકાસણી માત્રથી નિમણૂક માટેનો કોઈ હક્ક આપોઆપ ઉમેદવારને મળી જતો નથી. તેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
૮. સંબંધિત ઉમેદવારે વેબસાઇટમાં દર્શાવ્યા પ્રમાણે પ્રમાણપત્રોની ચકાસણી માટે નિયત સમય અને તારીખે મંડળની કચેરી ખાતે હાજર થવાનું રહેશે.